

ત્વરિત જાહેરાત માટે

એપ્રિલ 3, 2020

બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં બીજા કન્ફર્મ્ડ (પાકકા) COVID-19 કેસ પર સીટી ઓફ બ્રેમ્પટનનું નિવેદન

ગુરુવાર, એપ્રિલ 2 નાં રોજ, સીટી ઓફ બ્રેમ્પટનને માહિતગાર કરવામાં આવ્યું હતું કે તેની સેન્ડલવૂડ ટ્રાન્ઝિટ ઓપરેટરનું COVID-19 પરીક્ષણ હકારાત્મક (પોઝિટિવ) આવ્યું હતું. આ બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો બીજો કન્ફર્મ્ડ કેસ છે.

આ સમયે, સીટીની ટોચની અગ્રતા આ વ્યક્તિ અને તેઓના કુટુંબીજનોને સહાયતા પૂરી પાડવાની, અને અમારા કર્મચારીઓ, ગ્રાહકો અને આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાને સંરક્ષણ પૂરું પાડવાની મદદ ચાલુ રાખવાની છે.

સીટીને જાણ થઈ એટલે તરત જ, કર્મચારીઓ સહિયારી તપાસ કરવા માટે આગામી પગલાઓ નિર્ધારિત કરવા પીલ પબ્લિક હેલ્થ સાથે પ્રવૃત્તમય થયા.

એ જાણવામાં આવ્યું હતું કે ઓપરેટરે શનિવાર, માર્ચ 28 નાં રોજ નીચેના રૂટ્સ પર કામ કર્યું હતું:

- રૂટ 2 મેઈન
- રૂટ 501 ઝુમ ક્વીન
- રૂટ 505 ઝુમ બોવાર્ડ

પીલ પબ્લિક હેલ્થ આ ઓપરેટર સાથે ઘનિષ્ઠ સંપર્કમાં રહેલા સંબંધિત લોકોનો સીધો સંપર્ક કરી રહ્યું છે. પબ્લિક હેલ્થ સંપર્ક કરેલા લોકોને આગામી પગલાઓ અંગે સલાહ આપશે, જેમાં તેઓ સંસર્ગમાં આવ્યા ત્યારથી 14 દિવસ સુધી સેલ્ફ-આઈસોલેશનમાં રહેવાની અને લક્ષણો પર દેખરેખ રાખવાની સૂચના સામેલ છે.

ઉપર જણાવેલા દિવસોએ સમીક્ષા કરવામાં આવેલી બસો પર પ્રવાસ કર્યો હોય તેવા લોકો જેઓને સારું લાગતું હોય, કોઈ લક્ષણો ના જણાતા હોય, તેઓએ પોતાની રોજીંદી દિનચર્યા ચાલુ રાખવી જોઈએ અને પબ્લિક હેલ્થને ફોન કૉલ ના કરવો જોઈએ. જો તમને લક્ષણો વિકસે તો, કૃપા કરી પબ્લિક હેલ્થને કૉલ કરો. જો તમને ઈમરજન્સી મેડિકલ સહાયતા જોઈતી હોય તો, કૃપા કરી 911 નંબર પર કૉલ કરો.

પીલ પબ્લિક હેલ્થ એ પણ દર્શાવે છે કે સામાન્ય સમુદાયને હોય તેના કરતા કોઈ વધારાનું જોખમ ટ્રાન્ઝિટ બસ પ્રવાસીઓને રહેતું નથી.

સીટી સમુદાયને ખાતરી કરાવે છે કે તે COVID-19 નાં ફેલાવા સામે કર્મચારીઓ, ગ્રાહકો અને સમુદાયને સંરક્ષણ આપવામાં મદદ મેળવવા દરેક જરૂરી પગલું લેવાનું ચાલુ રાખશે.

વધારે સારી સફાઈ અને ચેપનાશક સમયપત્રક અમલમાં રહે છે. આ સમયે, બસ સેનિટાઈઝ કરવાનું કામ દર 24 કલાકે થાય છે. સગવડો અને ટર્મિનલ લંચરૂમ્સ, ટેબલ્સ, કાઉન્ટર્સ અને ડોર હેન્ડલ્સને દિવસમાં બે વખત સાફ અને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.

ઓપરેટરો અને ઉતારુઓ માટે શારીરિક અંતર જાળવવાને સહાયરૂપ થવા, નીચેના પગલાઓ અમલમાં છે:

- બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠકો સુધી સીમિત કરેલ છે.
- રીયર ડોર્સ (પાછળના ભાગના દરવાજાઓ) મારફતે પ્રવેશ અને ફ્રી ફેર્સ (ભાડા ચૂકવાણી વગર પ્રવાસ) અમલમાં છે. વધુમાં, મોબિલિટી ડિવાઈસીસ (ચલાયમાનતા સાધનો) ધરાવતા લોકો માટે ફ્રન્ટ ડોર્સ (આગળના દરવાજાથી) પ્રવેશ ચાલુ રાખ્યો છે ત્યારે, ઓપરેટરો અને ઉતારુઓ વચ્ચે જગ્યા પૂરી પાડવા પ્લાસ્ટિકની ચેઈન જેવો અવરોધ મૂકવામાં આવ્યો છે.
- બહુ વ્યસ્ત રૂટ્સ પર, ઉતારુઓ બસમાં હોય તે વખતે શારીરિક અંતર જાળવવા ઉતારુઓની ક્ષમતામાં સહાયરૂપ થવા આર્ટિક્યુલેટેડ બસો મૂકવામાં આવી છે.
- બેઠકોને સાર્થન બોર્ડથી ઓળખવામાં આવે છે અને ઉતારુઓને આ બેઠકો પર ન બેસવાનું કહેવામાં આવ્યું છે.
- વ્યસ્ત કામકાજના કલાકો દરમિયાન અને અઠવાડિક રજાઓમાં ઓછાં વપરાશના રૂટ્સ પર સર્વિસ રદ કરવામાં આવી છે. શારીરિક અંતર જાળવવામાં અને ભીડ પર કાબૂ રાખવામાં સહાયતા મેળવવા સંસાધનો નવી દિશામાં સૌથી વ્યસ્ત રૂટ્સ પર વાળવામાં આવ્યા છે.

સીટીએ પીલ પબ્લિક હેલ્થ સાથે ધનિષ્ઠપણે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આ તપાસ ચાલી રહી છે ત્યારે, નવી માહિતી ઉપલબ્ધ થાય એટલે તરત માહિતી પૂરી પાડવામાં આવશે.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca